



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૬/૨૦૧૮ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૫૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૩ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૮૭ લીટર દેશી દારૂ, ૧૪૬ બોટલ ઇંગ્લીશ દારૂ ૧ રિક્ષા અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૪,૧૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૫૨/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિની અટકાયત કરી હતી.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૦૫૩/૧૮

નારોલ : પ્રવિણભાઈ અજુજી ઠાકોર (ઉ.વ.૩૬)(રહે,ભવાનપુરાપીઠ રાયપુર દરવાજા બહાર, કાગડાપીઠ) એ તા.૩/૬/૧૮ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૬/૨૦૧૮ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નારોલ વિલ્સમ હોટલના ખાંચામાં કેલીકોનગર ખાતે પોતાના કાકાના દિકરા દેવાભાઈ ઇશ્વરજી ઠાકોર ને કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગલફતભરી રીતે ચલાવી લાવી ટક્કર મારતાં, શરીરે ગંભીર ઇજાઓ થતાં દેવાભાઈનું મૃત્યુ નિપજ્યુ હતું. આ ગુનાની તપાસ પો.સ..ઇ.શ્રી જે.બી.રાહોડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૫૪/૧૮

સાબરમતી: સાબરમતી પાર્વતીનગરની બાજુમાં ઓ.એન.જી.સી વર્કશોપ પાછળ શીતલ ઇન્ડીસ્ટીઝ ખાતે રહેતા અને ત્યાજ કંપનીમાં નોકરી કરતા રમેશકુમાર સખારામ સુથાર (ઉ.વ.૪૩) એ ડીપ્રેશનના કારણે તા.૩/૬/૧૮ નારોજ કંપનીના ગોડાઉનમાં નાચલોનની દોરી બાધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો. શ્રી દિનેશભાઈ મંગુભાઈ ચલાવે છે

શાહીબાગ: કિર્તિકુમાર કનુભાઇ વાઘેલા (ઉ.વ.૨૪)(રહે. મનુભાઇની ચાલી શાંતીપુરા જેઠાભાઇની ચાલી પાસે શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૩/૬/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ એ.કે.પટેલ ચલાવે છે.

ગોમતીપુર: કિશન ઉર્ફે મનીષભાઈ શ્રીરામ પ્રજાપતી (ઉ.વ.૨૬) (રહે. લાઇન નંબર- ૬ પઠાણની ચાલી વિક્રમ મીલ સામે ગોમતીપુર) એ બિમારીથી કંટાળી તા.૩/૬/૧૮ સવારના ૬/૦૦ વાગ્યા પહેલા પોતાના ઘરે છતના હુકમાં સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રણછોડભાઈ કરમશીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.